

પ્રકરણ - ૫

ઓળખ

વાળ

⇒ પરિચય અને મહત્વ :

હિસ્ક ગુંડાઓના કિસ્સામાં ઘણી વાર વાળ શરીરના વિવિધ ભાગો પરથી બીજી વ્યક્તિ પર, કપડાં પર અથવા ગુંડા સ્થળ પર કે અપરાધ માટે વપરાયેલ શાસ્ત્ર પર હેરફેર થાય છે. વાળ વિઘટન અને સડા પ્રત્યે પ્રતિરોધક હોય છે. જ્યારે ચહેરાના લક્ષણો અને ફિગરપિન્ટ્સ નાશ પામે છે. આથી જ વાળ ભૌતિક પુરાવા તરીકે અત્યંત મહત્વપૂર્ણ છે. બને ત્યાં સુધી આ પ્રકારના દરેક કિસ્સામાં એકત્રિત કરવા જોઈએ.

⇒ વાળની જાળવણી અને પ્રસરણ:-

- વાળનો નમૂનો સાક્ષીઓની હાજરીમાં ભેજાયા અને સ્વરચ્છ એવા કાગળના પરબીડિયા અથવા સેલોઝેનના પરબીડિયામાં એકત્રિત કરવા જોઈએ.
- બળાત્કાર અથવા જાતીય ગુંડાઓના કિસ્સામાં ભોગ બનનાર તથા શંકાસ્પદ વ્યક્તિના ગુપ્તાંગો પરથી મોડિકલ ઓફ્ફિસરના માર્ગદર્શન હેઠળ વાળ એકત્રિત કરવા જોઈએ. લોહી અથવા વીર્યમાં અથવા અન્ય ચીકણી સપાટી પર ચોટેલા વાળ ક્યારેય છુટા કે દૂર કરવા જોઈએ નહિ. અને તે સપાટી સાથે જ તેને પરીક્ષણ માટે પેક કરી પરીક્ષકને મોકલવા જોઈએ.
- ગુંડા સ્થળ પર છુટા પડેલા વાળ અને રેસાઓ વેક્યુમ કલીનરથી એકત્રિત કરવા જોઈએ.

⇒ વાળના સેમ્બલ લેવાની પદ્ધતિ :-

- શંકાસ્પદ વાળની સરખામણી અને ઉત્પત્તિ સ્થાન જાળવા માટે નમુનાના વાળની જરૂર પડે છે. જે માટે ખોપરીની ઉપરની ચામડી, ઢાઢી, ગુપ્તાંગ અથવા શરીરના અન્ય ભાગોના વાળના નમુના લેવામાં આવે છે.
- ખોપરીની ચામડી પરના વાળના નમુના લેવા માટેની યોગ્ય પદ્ધતિ એ સ્વરચ્છ અને દાંતાળા કંસકા વાળમાં જોરજોરથી ફેરવવામાં આવે છે.
- ગુનાહિત સ્થળેથી પુરાવારૂપે વાળ ના મળેલ હોય તો પણ મૃતકના શરીરના વિવિધ ભાગોથી વાળના નમુના અવશ્ય લેવા જોઈએ. ઉ.દા. તરીકે હત્યાની ઘટનાના ઘણાં દિવસો પછી પણ અગર એવા હત્યા માટે વપરાયેલા વાળ ચોટેલા હથિયાર મળી આવે કે જ્યારે મૃતદેહનો પણ નાશ કરી દેવામાં આવ્યો હોય. એવા કિસ્સામાં નમુનાના વાળનો મૃતકના વાળ સાથે સરખામણી કરી શકાય.

⇒ વાળની પ્રયોગશાળામાં પરીક્ષણ પરથી મળતી માહિતી:-

- પુરાવા રૂપે મળી આવેલ નમૂનો વાળનો જ છે કે નહીં તે જાણી શકાય છે.
- વાળનો નમૂનો મનુષ્યનો છે કે પ્રાણીનો તે જાણી શકાય છે.

~ ફોરેન્સિક સાયન્સ ~

- વાળની વિવિધ લાક્ષણિકતાઓ જેમ કે તેની લંબાઈ, વ્યાસ, રંગ, જડતા, આડ-છેદ, યોગ્ય આકાર તે મજ ચોટેલા કુચરાનો અભ્યાસ પરથી એ જાણી શકાય કે વાળ શરીરના કયા ભાગનો છે.
- વાળની સંપૂર્ણ લંબાઈ તથા તેનો પ્રત્યાવર્તન ક્ષમ ઇન્ટેક્શ એ સૂચિત કરે છે કે વાળ સ્ત્રીનો છે કે પુરુષનો વાળના મૂળમાં રહેલ barr body (બાર બોડીની) હાજરી પુરુષનો તેમજ ગેરહાજરી એ સ્ત્રીનો વાળ સૂચવે છે. વ્યક્તિની આશરે ઉંમર પણ તેના વાળ પરથી જાણી શકાય છે - વાળના મધ્ય ભાગ પર રંગક કણોનું આચાદન એ ઉંમર પ્રમાણે બદલાય છે. કોષીક પોટાશના દ્રાવકણમાં સગીર વયના વ્યક્તિના વાળના મૂળ એ વધુ વયના વ્યક્તિના મૂળની સરખામજીમાં વધુ જલ્દીથી દ્રાવ્ય થાય છે.
- વાળ રંગેલા છે કે કુદરતી રંગ છે તે પણ જાણી શકાય છે - રંગેલા વાળને માઈકોસ્કોપમાં અવલોકન કરતાં કુદરતી વાળની સરખામજીમાં વધુ શુષ્ફ જોવા મળે છે.
- વાળની કટ કેવા પ્રકારની છે તે જાણી શકાય છે - જો વાળ કટ એકદમ સીધી હોય તો કોઈ ધારદાર અભિનશસ્ત્ર/ સાધન ધ્વારા અને જો વાળનો છેડો અનિયમિત આકારે નુકસાનીયુક્ત જોવા મળે તો તે કોઈ બુદ્ધા શસ્ત્ર / અભિનશસ્ત્રના વપરાશ ધ્વારા થયેલ છે તે જાણી શકાય છે.
- લેબ પરીક્ષણથી નમુના વાળ એક ચોક્કસ વ્યક્તિના નથી એમ કહી શકાય પરંતુ આ વિશ્વાસથી નહી કહી શકાય કે આ વાળ ચોક્કસ રીતે આ માણસના જ છે, વાળમાં રહેલ રંગક દ્રવ્યોનું માઈકો રાસાયણિક પૃથ્વેકરણ અથવા વ્યવસાયિક દ્રવ્યોની વાળ પરની હાજરી એ વ્યક્તિગત સંબંધ હોવાની શક્યતા દર્શાવે છે. Neutron Activation Analysis (ન્યુટ્રોન એક્ટિવેશન એનાલિસીસ) પરથી વાળમાં રહેલા સૂક્ષ્મ તત્ત્વોની હાજરી ધ્વારા વ્યક્તિગત ઓળખાણની શક્યતા વધી જાય છે.

